

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરીણામ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૨-૧૦-૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત અને તા.૦૧-૦૬-૨૦૧૯ અને તા.૧૬-૧૧-૨૦૧૯ ની સુધારા જાહેરાત ક્રમાંક: ૧૫૦/૨૦૧૮-૧૯, અન્વયે “બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ”, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ-૧ તા.૨૪-૦૪-૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ હતી. ઉક્ત સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગાના આશરે ત્રણ ગણા ઉમેદવારો (૪૦% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં) ને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની યાદી **(અહીં ક્લિક કરો)** જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.

- આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં ૩ પ્રશ્ન રદ થયેલ હોઇ આ ૩ પ્રશ્નોના ગુણ સમભાગે (પ્રો-રેટા મુજબ) ૧૯૭ પ્રશ્નોમાં ઉમેરતાં પ્રત્યેક સાચા જવાબદીઠ ૧.૦૧૫ ગુણ અને પ્રત્યેક ખોટા, કોરા છોડેલ કે એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ જવાબના ૦.૨૫૪ ગુણ પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવેલ છે.
- માસ્ટર આન્સર કીના પ્રશ્ન ક્રમાંક ૮૫ અને ૮૬માં બે વિકલ્પોને સાચા જવાબ ગણવામાં આવેલ છે. આથી, આ બંને પ્રશ્નમાં બે વિકલ્પો પૈકી કોઈ એક અથવા બંને સાચા વિકલ્પ પસંદ કરેલ હશે તેવા કિસ્સામાં જવાબ સાચો ગણવામાં આવેલ છે અને અન્ય તમામ કિસ્સાઓમાં જવાબ ખોટો ગણવામાં આવેલ છે.
- મેરિટ યાદીને અનુલક્ષીને જનરલ કેટેગરી મુજબની વય ધરાવનાર ઉમેદવારોને પ્રથમ જનરલ કેટેગરીમાં સમાવવામાં આવેલ છે ત્યારબાદ જે તે સંબંધિત કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે.
- વિધવા ઉમેદવાર તથા માન્ય રમત-ગમત અને ખેલકૂદની સ્પર્ધામાં નિયત કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને સદર લેખિત પરીક્ષામાં તેમણે મેળવેલ ગુણના ૫% વધુ ગુણ ઉમેરવામાં આવેલ છે.
- આ પરીણામ એક કામચલાઉ યાદી છે અને તમામ ઉમેદવારોની પાત્રતા તેમની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પાત્રતા અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનને આધીન રહેશે.

ઉક્ત સંવર્ગની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ જુલાઇ-૨૦૨૨ માં યોજવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

સ્થળ: ગાંધીનગર
તા.૧૧-૦૬-૨૦૨૨

સચિવ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગાંધીનગર